

ત્વરિત જાહેરાત માટે

સિટીનો 2020 નો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ ઓનલાઈન ફલ્ક પર શરૂ થશે

બ્રમ્પટન, ઓન્ટારિયો (27 જુલાઈ 2020) – સીટી ઓફ બ્રમ્પટનનો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ ફરી મંગળવાર, 4 ઓગસ્ટ 2020ના રોજથી શરૂ થશે. આ વર્ષે સ્ટાપ અને રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં લેતા પ્રોગ્રામ ઓનલાઈન હાથ ધરાશે.

નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામનો હેતુ નાગરિક પ્રવૃત્તતામાં સુધારો લાવવાનો છે, નિવાસીઓનું સશક્તિકરણ કરવું જેથી તેઓ પોતાના પાડોશના વિસ્તારને ઉન્નત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે અને તેઓ સંસાધનો મેળવી શકે. રહેવાસીઓ પોતાના પાડોશના વિસ્તાર વિશે વધુ જાણકારી મેળવવાના અને પોતાને માટે શાનું મહત્ત્વ છે તેની ઓનલાઈન આપલે કરવા માટે ત્રણ નવા માર્ગો છે:

- **વર્ચુઅલ વોક્સ** – 15 પ્રોટેક્ટેડ વોક્સ નિયત તારીખોમાં સિટીની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવશે. રહેવાસીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ આ વોક્સ (સહેલ) ઓનલાઈન ફલ્ક પરથી લે અથવા પૂરા પાડવામાં આવેલ ટૂલ્સનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે રૂબરૂમાં ભૌતિક અંતર જાળવી રાખીને આવા વોક્સ લઈ શકે છે.
- **પાડોશ સર્વેક્ષણ** – સિટી સમાજના વિવિધ પાડોશને સમજવા માંગે છે તેમજ તે કે ત્યાં રહેતા નિવાસીઓ એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. પોતાના વિસ્તારો માટે રહેવાસીઓને ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
- **ઓનલાઈન મેપિંગ ટૂલ** – એક ઓનલાઈન મેપિંગ ટૂલથી રહેવાસીઓ તકો, સમસ્યાઓ અને બદલાવોને પોતાના પાડોશના વિસ્તારમાં શોધી શકશે.

નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ વિશે વધુ માહિતી અને વર્ચુઅલ નેબરહૂડ્સ વોક્સની આખી સૂચિ માટે અહીં મુલાકાત

લો www.brampton.ca/neighbourhoods.

હકિકતોનો ટૂંકસાર

- બ્રમ્પટન 2040 વિઝનમાં મુકમલ નેબરહૂડ્સ ઓડિટને મહત્ત્વપૂર્ણ કાર્ય પગલાનું સ્થાન આપવામાં આવ્યું હતું. નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામની શરૂઆત 2019માં થઈ હતી જેથી સમાજના પ્રતિભાવ લઈ શકાય, રહેવાસીઓને સંસાધનો સાથે જોડી શકાય અને લાંબે ગાળે એક એવી કાર્ય યોજનાનું સર્જન કરવું જે ખાસ સ્થાનિક પાડોશ માટે બની હોય.
- 2019માં સિટીએ 11 નર્ચરિંગ નેબરહૂડ્સની સહેલ પૂરી કરી હતી જેમાં 400 કરતા વધુ રહેવાસીઓ જોડાયા હતાં.

અવતરણો

“બ્રમ્પટન રંગોથી ભરેલ સાથિયો છે અને જ્યારે મહોલ્લા શેરીની વાત આવે જે તેઓ માટે પોતાનું ઘર જ છે, ત્યારે અમારા રહેવાસીઓ નિષ્ણાતો છે. નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ બ્રમ્પટનવાસીઓ માટે પોતાના સમાજમાં પ્રવૃત્ત થવાની નિતનવી તકો પૂરી પાડે છે અને હું આ વર્ષે પસંદ થયેલ 15 વિસ્તારોમાં રહેતા દરેક જણને વર્ચુઅલ વોક્સમાં ભાગ લઈને અને નેબરહૂડ્સ સર્વેક્ષણોમાં સહભાગી થઈને ઓનલાઈન મેપિંગ

ટૂલમાં ટિપ્પણી કરીને પોતાનો અવાજ સંભળાવા દેવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"સિટી જ્યારે COVID-19ના રોગચાળામાંથી ફરી બેઠું થઈ રહ્યું છે અને શક્ય હોય ત્યાં સવલતો ખોલી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષાનું મહત્ત્વ અકબંધ રહ્યું છે. આ વર્ષે નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ રહેવાસીઓને 15 સ્થાનિક પાડોશ વિશે પોતાના અભિપ્રાયો આપવાની સલામત રીત પૂરી પાડે છે અને સિટીને ટકાઉ સમુદાયો ઊભા કરવામાં મદદરૂપ થાય છે.

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રિજનલ કાઉન્સિલર, , વોર્ડ 3 & 4 પ્રમુખ, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી, સિટી ઓફ બ્રમ્પટન

"નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ રહેવાસીઓને તે બધું શેર કરાવે છે જે તેમને પોતાના સમુદાય વિશે ગમતું હોય, આગામી પ્રોજેક્ટ્સ વિશેની માહિતી જાણી શકે છે અને સ્થાનિક ધોરણે તેમને ક્યા પરિવર્તનો જોવા ગમશે તેવી પરિકલ્પનાઓની આપલે કરી શકે છે. આ વર્ષે પ્રોગ્રામ થોડો અલગ લાગશે પરંતુ રહેવાસીઓ પોતાના ઘરમાંથી પણ સલામત રીતે સામેલ થઈને પોતાનો પાડોશ સુધારી શકે છે."

- પેટ ફોર્ટિની, રિજનલ કાઉન્સિલર, , વોર્ડ 7 & 8 ઉપ-પ્રમુખ, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી, સિટી ઓફ બ્રમ્પટન

"COVID-19 મહામારી દરમિયાન સિટી બ્રમ્પટનના નિવાસીઓની સેવા કરવા પ્રતિબદ્ધ છે. હવે અમે જ્યારે નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામને ઓનલાઈન લઈ ગયા છીએ ત્યારે અમે નિવાસીઓ સાથે પ્રવૃત્ત રહેવા અને આપણા સમાજને સુરક્ષિત રાખવાની તેમની કલ્પનાઓ સાંભળવા ઉત્સુક છીએ."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca